

(A Kalpataru Group Enterprise)

July 27, 2022

Scrip Code: 522263	Trading Symbol: JMCPROJECT
Mumbai – 400 001	Mumbai – 400 051
Dalal Street,	Bandra-Kurla Complex, Bandra (East),
25th Floor, Phiroze Jeejeebhoy Towers,	Exchange Plaza, Plot no. C/1, G Block,
BSE Limited	National Stock Exchange of India Ltd.
Corporate Service Department	The Listing Department

Sub.: Newspaper Advertisement for transfer of equity shares to Investor Education and Protection Fund (IEPF) Authority

Dear Sirs,

Please find enclosed herewith the copies of notice published in newspaper of Ahmedabad edition viz. Indian Express (English) and Financial Express (Regional language) on July 27, 2022 as required under IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (Rules), inviting attention of concerned shareholders to lodge their claims in respect of unclaimed dividends of the Company for last seven consecutive years, failing which their shares would be transferred to IEPF Authority in accordance with Section 124(6) of the Companies Act, 2013 read with the Rules.

You are requested to take the same on your records please.

Thanking You,

Yours faithfully,

For JMC Projects (India) Limited

Samir Raval

Company Secretary & Compliance Officer

Encl.: As above

OJEOTS (INDIA)

TATA TATA POWER The Tata Power Company Limited

Bombay House, 24 Homi Mody Street, Mumbai 400 001. Website: www.tatapower.com CIN: L28920MH1919PLC000567

EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2022

			Quarter ended	l	Year ende
Sr.	Consolidated	30-Jun-22	31-Mar-22	30-Jun-21	31-Mar-22
۱o.	Consolidated	(Unaudited)	(Audited) (Refer Note 4)	(Unaudited)	(Audited)
a.	Total Income from Operations	14,495.48	11,959.96	10,132.35	42,815.67
o.	Profit / (Loss) before Exceptional items and tax	1,062.06	688.83	1,038.21	3,153.27
).	Profit / (Loss) before Tax	1,062.06	70.73	1,038.21	2,535.17
١.	Profit / (Loss) for the period/year	883.54	632.37	465.69	2,155.6
	Total Comprehensive Income	1,254.12	849.54	1,044.00	2,629.0
	Paid-up Equity Share Capital (Face Value: ₹ 1/- per share)	319.56	319.56	319.56	319.5
	Reserves (excluding Revaluation Reserve)	23,060.30	21,894.97	21,009.92	21,894.9
	Securities Premium Account	3,107.54	3,107.54	3,107.54	3,107.5
	Net worth	23,679.74	22,789.17	21,147.41	22,789.1
	Outstanding Debt	54,215.22	52,011.37	52,916.46	52,011.3
.	Debt Equity Ratio (in times)	1.99	2.00	2.14	2.0
Earnings Per Equity Share (of ₹ 1/- each) (not annualised) Basic and Diluted: (In ₹)					
	(i) From Continuing Operations before net movement in regulatory deferral balances (ii) From Continuing Operations after net movement in	1.66	2.80	1.37	7.0
	regulatory deferral balances	2.48	3.04	1.13	6.8
	(iii) From Discontinued Operations		(1.46)	-	(1.46
	(iv) Total Operations after net movement in regulatory		, ,		,
	deferral balances	2.48	1.58	1.13	5.3
١.	Capital Redemption Reserve	515.76	515.76	515.76	515.7
.	Debenture Redemption Reserve	525.06	525.06	625.06	525.0
	Debt Service Coverage Ratio (in times) (not annualised)	1.12	0.82	1.29	1.0
	Interest Service Coverage Ratio (in times) (not annualised)	2.08	1.70	2.15	1.8

The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 26th July, 2022.

	Quarter ended		l	Year ended	
Sr.	Standalone	30-Jun-22	31-Mar-22	30-Jun-21	31-Mar-22
No.	Statidatorie	(Audited)	(Audited) (Refer Note 4)	(Unaudited)*	(Audited)
a.	Total Income from Operations	4,828.92	3,119.95	2,791.37	11,107.93
b.	Profit / (Loss) before Exceptional items and tax	417.44	1,427.51	557.89	1,345.69
c.	Profit / (Loss) before Tax	417.44	852.86	557.89	2,289.97
d.	Profit / (Loss) for the Period/Year	421.44	1,820.47	354.16	2,782.93
e.	Total Compréhensive Income	412.59	1,830.05	750.23	3,097.26
f.	Paid-up Equity Share Capital (Face Value: ₹ 1/- per share)	319.56	319.56	319.56	319.56
g.	Reserves (excluding Revaluation Reserve)	10,885.04	10,472.45	8,486.18	10,472.45
ĥ.	Securities Premium Account	3,107.54	3,107.54	3,107.54	3,107.54
i.	Net worth	9,953.68	9,532.24	7,330.53	9,532.24
j.	Outstanding Debt	26,693.41	28,076.32	30,290.44	28,076.32
k.	Debt Equity Ratio (in times)	2.36	2.58	3.36	2.58
I.	Earnings Per Equity Share (of ₹ 1/- each) (not annualised) Basic and Diluted: (In ₹)				
	(i) From Continuing Operations before net movement in				
	regulatory deferral balances (ii) From Continuing Operations after net movement in	0.29	6.93	1.09	9.76
	regulatory deferral balances	1.32	7.16	1.02	10.07
	(iii) From Discontinued Operations (iv) Total Operations after net movement in regulatory	-	(1.46)	-	(1.46)
	deferral balances	1.32	5.70	1.02	8.61
m.	Capital Redemption Reserve	4.51	4.51	4.51	4.51
n.	Debenture Redemption Reserve	296.95	296.95	296.95	296.95
Ο.	Debt Service Coverage Ratio (in times) (not annualised)	1.21	3.10	1.15	1.09
p.	Interest Service Coverage Ratio (in times) (not annualised)	1.75	3.72	1.98	1.62

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulatior 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financia Results is available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.tatapower.com.

website www.tatapower.com.
The figures of the quarter ended March 31, 2022 are the balancing figures between audited figures in respect of the full financia year ended March 31, 2022 and the unaudited published year-to-date figures upto December 31, 2021 which were subjected to For and on behalf of the Board of THE TATA POWER COMPANY LIMITED

Date: **26th July, 2022** Place: **Mumbai**

EIH Associated Hotels Limited

CIN: L92490TN1983PLC009903

Registered Office: 1/24, G.S.T. Road, Meenambakkam, Chennai - 600 027 Ph.: +91-44-2234 4747 Fax: +91-44-2234 6699 Website: www.eihassociatedhotels.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2022

				(Rs. in Lakhs)
		3 months ended 30.06.2022 UNAUDITED	12 months ended 31.03.2022 AUDITED	ended 30.06.2021
1	Total Income from operations	6,129.80	19,777.31	1,317.03
2	Net Profit/(Loss) before tax (before Exceptional and/or Extraordinary items)	808.14	1,882.18	(1,689.44)
3	Net Profit/(Loss) before tax (after Exceptional and/or Extraordinary items)	808.14	1,838.99	(1,689.44)
4	Net Profit/(Loss) after tax (after Exceptional and/or Extraordinary items)	568.14	1,288.24	(978.05)
5	Total Comprehensive Income for the period	589.93	1,359.52	(971.35)
6	Paid-up Equity Share Capital (Face Value - Rs. 10 each)	3,046.81	3,046.81	3,046.81
7	Other Equity (excluding Revaluation Reserve) in the audited Balance Sheet as at 31st March, 2022		30,187.17	
8	Earnings per Equity Share on net profit after tax (fully paid up equity share of Rs. 10):			
((a) Basic	1.86	4.23	(3.21)
(b) Diluted		1.86	4.23	(3.21)
National				

- 1 The above is an extract of the detailed format of the Statements of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statements of Financial Results are available on the Company's website (www.eihassociatedhotels.in) and on the websites of the National Stock Exchanges of India Limited (www.nseindia.com), BSE Limited (www.bseindia.com).
- The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at the meetings held on July 26, 2022. The statutory auditors have carried out a limited review of these financial results.

VIKRAMJIT SINGH OBEROI MANAGING DIRECTOR DIN: 00052014

indianexpress.com



I arrive at a conclusion not an assumption.

Inform your opinion with detailed analysis.

New Delhi

26th July, 2022

The Indian Express. For the Indian Intelligent.



Ullethae

સેડના ખર્ચે તૈયાર થયેલી વડોદરા ઉત્તર જય પાણી પુરવઠા યોજના

Public Notice All that piece and parcel of **Plot No. A-524**, admeasuring about 126.34.61

Sqmt. i.e. 151.11 Sq.yds with construction thereon situated at land bearing R.S.No. 25/1, 25/2, 26, 27, 28, 29/1, 29/2, 30/1, 31, 32/1, 32/2, 33, 34 Falki, 35, 36/1 Paiki, 36/2, 37/1, 37/2/A Paiki, 37/2/B, 37/3, 38/1, 38/2 38/2 Paiki, 39/1, 39/2, 40/1, 40/2, 41, 42, 43, 44, 45, 46/1, 46/2, 48, 49 50/4 55/1 & 55/2 of Pramukh Park situated at Vill Bhedwad Tal Surat 50/4, 33/1 & 53/20 Framush Fark statted at viii. Bledwat, 1at. Sura City (Old Tal. Choryasi) of District Surat was owned by Kantibha Shivrambhai Patel by virtue of Registered Sale Deed No. 6533 Dt. 5/12/ 2001 (New No. 1744 Dt. 1/3/2002). Then after, Kantibhai Shivrambha Patel was passed away on Dt. 16/2/2014. So, (1) Manguben Wd/o Kantibhai Shivrambhai Patel, (2) Anilbhai Kantibhai Patel (3) Sunilbhai Kantibhai Patel & (4) Shaifaliben Kirtibhai Patel D/o, Kantibhai Shiyrambhai Patel are only the legal heirs of Late Kantibhai Shivrambhai Patel. So, Pedigree also issued by Talati cum Mantri, Pandesara/ Bhedwad, Surat. Hence, from legal Heirs of Late Kantibhai Shivrambhai Patel the said property is purchased by my client Piyushkumar Jashvantlal Patel by virtue of Regis-tered Sale Deed No. 10013 dtd. 3/9/2014. And said plot owner have de cided to mortgage the said property with IDFC First Bank Ltd. Hence, that if any body is having rights or interest & who claimed as Legal heirs of Late Kantibhai Shivrambhai Patel in the abovementioned Plot, except mentioned Family Tree i.e. Pedhinamu shall communicate the same to the undersinged at my address within 7 days of publication this notice and if no objection is received against the same during the period of this notice then my client shall have every right to believe that there is no anyone legal heirs except shown in family tree and will proceed further for completion of loan proceedings.

Date: /7/2022 Add: B/2-201, Umiya Nagar Flats, Sagar D Patel Advocate Mo.No. 9265502240, 8401182655

JMC Projects (India) Limited (A Kalpataru Group Enterprise)

CIN: L45200GJ1986PLC008717 **Regd. Off.:** A-104, Shapath 4, Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad - 380015. **Tel:** 079 68161500, **Fax:** 079 68161560,

E-mail: cs@jmcprojects.com, Website: www.jmcprojects.com NOTICE Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority

This notice is being given pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") as amended from time to time by the Ministry of Corporate Affairs (MCA). As per the Rules notified by the MCA, the Company needs to transfer the shares held by the Shareholders either in physical form or dematerialized form to the Investo Education and Protection Fund Authority (IEPF Authority) in respect of which dividend has not been claimed for seven consecutive years or more

In accordance with the Rules, Shareholders may note that the unpaid/unclaimed final dividend for the financial year 2014-15 would be transferred to IEPF along with underlying shares in respect of which dividend has not been claimed for sever consecutive years from the financial year 2014-15 onwards. Adhering to the various requirements set out in the Rules, the Company has already communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Authority for taking appropriate action(s) and details of such Shareholders are available on the website of the Company viz. www.jmcprojects.com unde 'Investors' tab.

The concerned Shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company would be issuing nev share certificate(s) in lieu of the original held by them for the purpose of transfer o shares to IEPF and upon such issue, the Company shall inform the depository by way of corporate action to convert the new share certificate(s) into Demat form and transfer in favour of IEPF. The original share certificate(s) which are registered in the name of shareholders will stand automatically cancelled and be deemed nonnegotiable. The concerned Shareholders holding shares in dematerialized form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the Demat account of the IEPF. The Shareholders may further note that the details made available by the Company on its website shall be deemed adequate notice ir respect of issue of new share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF.

For claiming unpaid / unclaimed dividend, the concerned Shareholder may contact on or before November 03, 2022 to the Company's Registrar and Transfer Agent M/s Link Intime India Pvt. Ltd., 506 to 508, 5th Floor, Amarnath Business Centre (ABC-1) Nr. St. Xavier's College Corner, Off. C. G. Road, Navrangpura, Ahmedabad - 380009 Telephone & Fax No.: 079 26465179, Email: iepf.shares@linkintime.co.in. The Company shall with a view to adhering with the Rules, transfer the shares to the IEPF by the due date. Consequent thereto, no claim shall lie against the Company in respect of such unclaimed dividend and underlying shares. The concerned shareholder may note that upon such transfer, they can claim the said shares along with dividend(s) from IEPF Authority, details of which are available at www.iepf.gov.in For JMC Projects (India) Limited

Place: Mumbai Date: July 26, 2022

Samir Rava Company Secretary (Nodal Officer)

t committed

ach drop of water is precious. Water is the basic necessity for functioning of all life forms that exist on earth. It is impossible to dream and live life without water.

Like Oxygen, water is equally important for survival and growth. From agriculture to animal husbandry, industries, construction-water is required in every single area

If we study ancient human civilization across the world, it will be found that it was developed near river banks. Water is an essential part of life and vital for sustainability and is one of the most significant resources on this planet, not to mention one of the most precious gift of God on earth.

In past, there was acute shortage of drinking water in Gujarat. Especially during summer, majority parts of the state was gripped with low water levels, drinking water crises and poor quality of potable water.

The state government under the visionary leadership of Narendra Modi gave high priority to water security and resolve serious water issues in the state. The efforts have brought constructive solutions too age old water crises through 'Jal Sanchay' and 'Jal Sinchan' by ensur-



ing maximum water conservation and judicious use of available water sources in the state.

Taking ahead the vision of water management of Prime Minister Narendra Modi, around 96 % houses in Gujarat today receive water through 'Nal Se Jal' scheme.

The scarcity of drinking water has today become a history in Gujarat. For this the state government has developed state-wide water grid and has setup robust planning to supply drinking waters to every house through a water-pipeline in the state. This has also positioned Gujarat as a pioneer state in India in terms of moving towards water security and conservation, a policy choice that has boosted economic growth.

Development of State-Wide Drinking Water Supply Grid

In a bid to mitigate the problem of water scarcity, the Gujarat government undertook the development of state wide drinking water supply grid phase wise. With main sources of the grid comprising of Narmada water and other local sources including Dams, Canals and Rivers.



Under this, around 2684 kilometres long Narmada based bulk pipeline and 45 main pumping stations (150 MW) have been constructed connecting 9904 villages . In addition to this, another 4085 villages have been covered under surface based schemes. In all, a total of 13989 villages have been covered under various water supplies schemes.

PRAVEER SINHA CEO & Managing Director DIN 01785164

With aim to provide water security to every village of the state, water works is in progress in 1187 villages under various schemes and planning work is in progress at 2347 villages.

State wide around 3200 MLD of water distribution is done through water supply grid which is an increase of 2950 MLD of water in past 20 years.

The ensure sufficient water supply, the state is equipped with 1120 high water storage tanks, 1918 underground water storage tanks, 1263 head works, 266 water filter plants of 4118 MLD capacity and over 1.20 lacs kilo-

metres long water distribution pipe line has been constructed. In lines with phase wise grid development, the state has massively worked towards improvement in the standards of drinking water supply.

In 2009, the daily water supply per person increased from 40 to 70 liters of water which further increased to 100 liter per person in 2013. In this way, the state government has provided huge facility to ensure pure, clean and safe drinking water in every village of Gujarat by putting an end to server water crises.

Recently, Gujarat Chief Minister Bhupendra Patel sanctioned works worth Rs 1,566 crores to fill up lacs in nearly 135 villages of Banaskantha and Patan districts with Narmada water. This is expected to benefitaround 1.5 lacs hectares of land and benefit over 30,000 families with drinking and irrigation water apart from livestock.

Improvement in pipe designing network under group schemes

In Gujarat, telescopic network model was used to supply and distribute water under group water supplies schemes. This design was simple and less costly but had many disadvantages including unequal water distribution, low water pressure and internal difficulties in pipeline net-

Added to this whenever repairing work was undertaken, water supply was disrupted in large number of villages.

To combat the issue, a new scheme 'Hub and Spoke' model was used for water supply.

The hub and spoke model refers to a distribution method in which a centralized "hub" exists. Everything either originates in the hub or is sent to the hub for distribution to consumers. From the hub, water travels outward to smaller locations called spokes, for further processing and distribution.

This system had various advantages. Apart from equal water distribution, new villages could be easily added, current infrastructure could be optimised and there was ease in repairing and it's management.

Individual Village Scheme and Tap Connection Facility

Gujarat has made important strides to ensure that most parts of the state become water secure. Today, the state claims to cover all the villages of the state through 100% pipe line scheme. As mentioned



earlier, the state distributes 100 liters of water per day per person. Gujarat has progressed from tanker raj to Nal se Jal according to the

 Agriculture Minister. In past water distribution which use to take place through tankers during summer has

decreased. According to available data last year there were only 45 villages were water was supplied through tankers.

> To ensure water security to the coastal villages

Saurashtra and

Kutch region and to reduce dependency on Narmada, desalination plants are under construction with the capacity of 27 crores liters in Mandvi, Saurashtra, Dwarka, Gir Somnath, Gogha and surrounding areas. Through this project complete dependency on Narmada river during water crises will be reduced.

Promising Drinking Water Supply Facts

- There are 91.77 lacs rural houses in Gujarat of which drinking water is supplied to 84.53 lacs houses through taps
- In 12 districts and 123 talukas and 14477 villages of the state. clean drinking water is supplied 100% through 'Har Ghar Jal'
- The state government has placed the target of supplying clean drinking water through taps covering 100% rural area by September 2022.
- The state has 18402 mini pipe schemes in place
- The state has around 2.85 lacs hand pumps
- The mega investment done in the Water Supply Works in Gujarat stood to Rs.939.25 crores in 2001-02 and Rs.4487.29
 - In past 20 years Rs.46600 crores have been invested by giving priority to clean drinking water.





U GRO ચુ ગ્રો કેપીટલ લિમીટેડ

ચોથો માળ, ટાવર-૩, ઈક્વિનોકસ બિઝનેશ પાર્ક, એલબીએસ રોડ, કુર્લા, મુંબઈ-૪૦૦૦૭૦.

માંગણા નોટીસ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ

એક્ટ ,૨૦૦૨ (એક્ટ) અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨, (નિચમો)ની જોગવાઇઓ હેઠળ **યુ ગ્રો કેપિટલ લીમીટેડ**ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીની રૂએ અને નિયમ ૩ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ (૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચેના દેવાદાર(રો)ને સંબંધિત નોટીસ(સો)માં જણાવેલ રકમ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. કારણોસર નીચે સહી કરનાર માને છે કે દેવાદાર(રો) માંગણા નોટીસર્ન બજવણી ટાળી રહ્યાં છે, પરિણામે માંગણા નોટીસની બજવણી નિયમો મુજબ એફીક્શેશન અને પ્રકાશન દ્વારા પ્રકાશીત કરવામાં આવી રહી છે. માંગણા નોટીસ(સો)ની વિગતો અહીં નીચે આપેલ છેઃ

The tot Coto. The east total (tot) the entire total to the entered					
દेવાદાર(रो)नुं नाम / લोन એકાઉન્ટ नं.	માંગણા નોટીસની તારીખ અને રકમ	સિક્ચોર્ડ મિલકત(તો)ની વિગત			
 હરિકૃષ્ણ પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડ મહેશભાઈ કલ્યાણભાઈ દેલવડિયા 	૧૩-૦૭-૨૦૨૨ ३ા.૩,૮૯,૭૦,૯૩૧/-	સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા સબ-પ્લોટ નં. ૯૦, આશરે ક્ષેત્રકળ ૩૩૭૮.૨૫ ચો. મી. એટલે ૪૦૪૦.૩૮ ચો. યાર્ડ			
3. નારાચણભાઈ કલ્યાણભાઈ દેલવડિયા	તા.૧૧-૦૭-૨૦૨૨	અને બાંધકામ સહિત તેના પર આવેલ સ્કીમ કે જે ''સોપાન કેસર			
૪. મનીષાબેન મહેશભાઈ દેલવડીયા ૫. કોમલબેન નારાચણભાઈ દેલવાડીયા	ના રોજ	ઈન્ડસ્ટ્રીયલ હબ"ના નામથી ઓળખાય છે. જેનો સર્વે નં. ૩૫૯ પૈકી (જુનો સર્વે નં. ૩૫૯, ૩૬૦/૧/૨, ૩૬૧ પૈકી ૨), કેસર સીટી પાસે,			
ક. હીરાબેન કલ્યાણભાઈ દેલવડિયા • • • • • • • • • • • • • • • • • • •		સર્વોદય હોટલ પાસે, મોજે ગામ મોરૈયા, તાલુકો સાણંદ, જીલ્લો			
७. કેલ્સન ઇન્કિયા ફૂડ્સ એકાઉન્ટ નં. 380001SEC0011503,		અમદાવાદ અને રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીકટ સાણંદ			
380001SEC0026563 ਅਗੇ HCFAHMSEC00001009798					

દેવાદાર(રો)ને આથી માંગણા નોટીસ(સો)નું પાલન કરીને તેમાં જણાવેલ માંગણાની રકમ તેમજ ચુકવણીના છુટકારાની તારીખ સુધી લાગુ વ્યાજ, લેટ પેમેન્ટ પેનલ્ટી, બાઉન્સ ચાર્જીસ, કોસ્ટ અને ખર્ચ વગેરે આ પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા સલાહ છે દેવાદાર(રો)એ નોંધ લેવી કે યુ ગ્રો કેપીટલ લીમીટેડ સિક્યોડર્ લેણદાર છે અને દેવાદારોએ લીધેલ લોન સવલત યુગ્રો કેપીટલ લીમીટેડમાં દેવાદાર (રો) દ્વારા ગીરો સિક્યોર્ડ મિલકત (તો)ની સ્થાવર મિલકતો સામે સિક્યોર્ડ ડેબ્ટ છે.

જણાવેલ સમયગાળા દરમિયાન દેવાદારો તેમની પુરીપુરી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશે તો, યુ ગ્રો કેપીટલ લીમીટેડ દેવાદાર(રો)ના લોન એકાઉન્ટમાં બાકી રકમની વસુલાત કરવા માટે એક્ટ અને તે હેઠળના નિયમો અંતગર્ત સિક્યોર્ડ એસેટનો કબજો લેવા માટે સહીત તેમજ વેચાણના માર્ગે તેની તબદિલી સહીત પરંતુ તે પુરતા મર્યાદિન નહીના એક્ટની કલમ ૧૩ (૪) હેઠળના તમામ હકોનો અથવા અન્ય ઉપાયોનો ઉપયોગ કરશે. યુગ્રો કેપીટલ લીમીટેડ વેચાણ અથવા તબદીલીના હકોનો ઉપયોગ કરતા પહેલા સિક્યોર્ડ મિલકતોને ટાંચમાં લેવા અને/અથવા સીલ કરવાની સત્તા પણ ધરાવે છે. સિક્યોર્ડ એસેટના વેચાણ પછી, યુગ્રો કેપીટલ લીમીટેડ, જો સિક્યોર્ડ મિલકત(તો)ની કિંમત યુ ગ્રો કેપીટલ લીમીટેડને દેવાદારો દ્વારા ચુકવવા પાત્ર બાકી રકમ મેળવવા પુરતો ન હોય, તો તેવા કિસ્સામાં બાકી રકોની વસુલાત માટે અલગ કાનુની કાર્યવાહી શરૂ કરવાનો હક પણ ધરાવે છે. આ ઉપાયો કોઇપણ અન્ય કાનુન હેઠળ યુ ગ્રો કેપીટલ લીમીટેડને પ્રાપ્ત તમામ અન્ય ઉપાયો ઉપરાંતન અને સ્વતંત્ર છે

સિક્યોર્ડ મિલકત(તો) પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ (૮) ની જોગવાઇઓ અને આ ઉપરાંત એક્ટની કલમ ૧૩ (૧૩) પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે, જે હેઠળ દેવાદાર(રો)ને યુ ગ્રો કેપીટલ લીમીટેડની આગોતરી લેખીત મંજુરી વગર સિક્યોર્ડ મિલકત(તો)ના વેચાણ, ભાડે અથવા અન્ય રીતે (વ્યવસાયના સામાન્ય કામકાજો સિવાય) નિકાલ અથવા સોદો અથવા તબદીલી કરવાનાની મનાઇ / પ્રતિબંધિત કરવામાં આવે છે અને તેનું ઉલ્લંઘન એક્ટની કલમ ૨૯ હેઠળ સજાપાત્ર ગુનો છે. માંગણા નોટીસ(સો)ની નકલ નીચે સહી કરનાર પાસે પ્રાપ્ય છે અને દેવાદાર(રો), જો ઇચ્છે તો, નીચે સહી કરનાર પાસેથી તે મેળવી શકો છો.

સહી/- પીનાકી પોલ (અધિકૃત અધિકારી) યુ ગ્રો કેપીટલ લિમીટેડ તારીખઃ ૨७.૦७.૨૦૨૨ authorised.officer@ugrocapital.com



સ્થળ : અમદાવાદ

KARNATAKA NEERAVARI NIGAM LIMITED

(A Government of Karnataka Enterprise) CIN No.: U85110KA1998SGC024503 No.1, Coffee Board Building, 4th Floor, Dr B R Ambedkar Veedhi, Bangalore-560 001 Tel No. (080) 22283074-78, Fax (080) 22386015, E-mail: knnl@knnlindia.com, Website: www.knnlindia.com

Statement of Un-audited Financials Results for the Quarterly and Nine Months Ended 31st December 2021

SI. No.	Particulars	3 months ended (31.12.2021)	Preceding 3 months ended (30.09.2021)	Year to date for the Current year 9 months ended 30.12.2021	Previous year ended 31.03.2021
_	T. I. I. C	Unaudited	Unaudited	Unaudited	Audited
2	Total Income from Operations	3,106.83	3,690.92	8,028.05	13,124.37
2	Net Profit (+) / Loss (-) for the period (before tax, Exceptional and Extraordinary items)	(17,682.77)	(28,976.11)	(62,216.70)	(92,813.31)
3	Net Profit (+) / Loss (-) for the period before tax (after Exceptional and Extraordinary items)	(17,682.77)	(28,976.11)	(62,216.70)	(92,813.31)
4	Net Profit (+) / Loss (-) for the period after tax (after Exceptional and Extraordinary items)	(17,682.77)	(28,976.11)	(62,216.70)	(92,813.31)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ Loss for the period after tax and other Comprehensive income after tax)	(17,682.77)	(28,976.11)	(62,216.70)	(92,810.34)
6	Paid-up equity share capital (Rs. 1,000/- each)	3,573,345.56	3,573,345.56	3,573,345.56	3,072,496.36
7	Reserves (excluding Revaluation Reserves)	(565,695.14)	(604,082.77)	(565,695.14)	(244,554.53)
8	Net Worth	3,007,650.42	2,969,262.79	3,007,650.42	2,827,941.83
9	Paid up Debt Capital	319,379.96	333,202.82	319,379.96	372,327.53
10	Outstanding Redeemable Preference Share			-	-
11	Debt Equity Ratio	0.11	0.11	0.11	0.13
12	Earnings Per Equity Share (EPS) of Rs. 1000 each (for Continuing & Discontinued Operations)				
	(1) Basic	(4.95)	(8.39)	(18.48)	(31.53)
	(2) Diluted	(4.77)	(8.21)	(17.79)	(27.85)
13	Capital Redemption Reserve	-	-	-	=
14	Debenture Redemption Reserve	-	-	-	-
15	Debt Service Coverage Ratio	(0.01)	(0.11)	(0.11)	(0.20)
16	Interest Service Coverage Ratio	(0.21)	(1.81)	(0.69)	(0.91)
17	Current Ratio	0.26	0.27	0.26	0.36
18	Long term debt to working capital	(0.69)	(0.84)	(0.69)	(0.96)
19	Bad debts to Account receivables Ratio	-	-	-	-
20	Current Liability Ratio	0.70	0.66	0.70	0.69
21	Total debts to total assets	0.08	0.09	0.08	0.10
22	Debtors Turnover	0.49	0.64	1.26	2.69
23	Inventory Turnover	NA	NA	NA	NA
24	Operating Margin (%)	-589.67%	-423.72%	-525.39%	-410.65%
25	Net profit Margin (%)	-90.85%	-151.45%	-129.13%	-96.03%
26	Sector specific equivalent ratios	NA	NA	NA	NA

The above is an extract of the detailed format of Quarterly/Nine months ended 31st Dec, 2021 Financial Results being filed with the National Stock Exchange under Regulation 52 of the SEBI (Listing Obligations and disclosure Requirements) Regulations, 2015. The full Format of the Quarterly/Nine months ended 31st Dec, 2021 financial results will be available on the website of the National Stock Exchange and the Listed Entity: www.knnlindia.com

Formula used for calculation of ratios as follows	
Net Worth = Paid-up equity share capital + Reserves (excluding Revaluation Reserves)	Current Liability Ratio = Current Liabilities/Total Liabilities
Debt Equity Ratio = Total Debts/Equity	Total debts to total assets = Total Debts/Total Assets
Debt Service Coverage Ratio = Earnings before Depreciation, Interest and Tax/ (Interest + Principal Repayment)	Debtors Turnover =Turnover or Total Revenue/ Debtors
Interest Service Coverage Ratio = Earnings before Depreciation, Interest and Tax / Interest Expense	Inventory Turnover = Turnover or Total Revenue /Inventory
Current Ratio = Current Assets/Current Liabilities	Operating margin (%) = Operating Profit /Net Sales or Total Revenue*100
Long term debt to working capital = Long term debts/working capital	Net profit margin (%) = Net Profit /Net Sales or Total Revenue*100
Bad debts to Account receivables ratio = Bad debts/ Account receivables	
Place: Bangalore Date: 25.07.2022	Sd/- Managing Director

अन्या Andhra Corporation

यूनियन बैंक 🕼 Union Bank | **ખાનપુર શાખા,** પી.એ. એસ્ટેટ બિલ્કીંગ, કામાં હોટલ સામે, ખાનપુર, અમદાવાદ **ઇમેલ : ubin0536150@unionbankofi**i

નિયમ ૮(૧)) કબજા નોટીસ

આથી નીચે સહી કરનારે **યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ખાનપુર શાખા, અમદાવાદના** અધિકૃત અધિકારી તરીકે સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ કાયદો, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કાયદાર્ન ક્લમ ૧૩ (૧૨) हेठળ भणेली सत्तानी ३એ **२८मी એप्रिल, २०२१ नी** तारीजनी डिमान्ड નોટીસ જારી કરીને દેવાદાર **શ્રી કમલેશભાઇ રતિલાલ પટેલને** નોટીસમાં જણાવેલ **૩ા** ૯,૬७,૫૪७.૮૪ (શબ્દોમાં રૂપિયા નવ લાખ સડસઠ હજાર પાંચસો સુડતાલીસ અને ચોર્યાસી पैसा) तरीङेनी रङम वता व्याप अने ખર્ચાओ કथित नोटीस मण्यानी तारीખथी ६० દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું.

हेवाहार तेमल लामीनहारो डुल रङमनी परत यूडवणी डरवामां निष्हण गया होवाथी દેવાદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે અહીં નીરે વર્ણવેલી મિલકતનો કબજો કથિત નિયમોના નિયમ ૮ સાથે વંચાતી કથિત કાયદાની કલમ 93(x) ਠੇਨਯ ਰੇਸਕੇ/ਰੇਾਹੀਕੇ ਮਾਮ ਲਗਾਕੀ 3એ અમદાવાદ ખાતે **ਹੀક ਮੇਟੀਪੀਕਿਟਕ ਮੇજਿસ્ટੇਟਕ** તા. ૨૮.૦૪.૨૦૨૨ ના આદેશ નં. સીઆરએમએ/જે/૧૨७૩/૨૦૨૨ ના આદેશ અનુસાર આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ (એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ) કોર્ટ નં. ૨૧ ખાતે ૨૪મી **જુલાઈ, ૨૦૨૨ ના રોજ** લઈ લીધો છે/મેળવી લીધો છે.

સેક્ચોર્ડ મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે કથિત કાયદાની કલમ ૧૩ ની પેટા ક્લમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે દેવાદાર/જામીનદારનું ધ્યાન દોરવામાં આવે છે .

ખાસ કરીને દેવાદાર/જામીનદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઈપણ વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવે છે અને મિલકતો સાથે કરાયેલા કોઈપણ વ્યવહારનો ચાર્જ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ખાનપુર શાખા, અમદાવાદની તા. ૩૧.૦૩.૨૦૨૧ મુજબની રૂા. e,,૬७,૫૪७.૮૪ (શબ્દોમાં રૂપિયા નવ લાખ સડસઠ હજાર પાંચસો સુડતાલીસ અને ચોર્ચાસી પૈસા) તરીકેની રકમ અને તેની પરના આગળના વ્યાજ અને ખર્ચાઓને આધિન રહેશે.

સ્થાવર મિલકતોનું વર્ણન

રજસ્ટ્રેશન જુલ્લા અમદાવાદ અને ઉપ-જુલ્લા અમદાવાદ-૧૨ (નિકોલ) માં તાલુક અસારવા, મોજે નિકોલના સર્વે નં. ૨૨૫/૪ ધરાવતી શ્રુતિ ઓનર્સ એસોસિએંગન ની જમીન પર બંધાયેલ કેદાર એપાર્ટમેન્ટમાં જમીનના 39.૮૪ ચો.મી. અવિભાજી હિસ્સા સહિત ૩૧૧ માળે ૪૪.૦૦ ચો.મી.માપના બાંધકામના ફ્લેટ નં. ડી-૧૨ તરીકેની મિલકતના તે તમામ પીસ અને પાર્સલ. **મિલકત શ્રી કમલેશકુમાર** रित**लाल पटेलना** नामे रहेल छे. **यतुःसीमाः ઉत्तरः** सोसायटीनो ङोमन रोड દક્ષિણ: ડી/૧૧ બ્લોક, પૂર્વ: નિકોલ ગામ માટેનો રોડ, પશ્ચિમ: રોડ

અધિકૃત અધિકારી તારીખ : ૨૪.૦७.૨૦૨૨ સ્થળ : અમદાવાદ युनियन भेंड गोइ ईन्डिया

જેએમસી પ્રોજેક્ટ્સ (ઇન્ડિયા) લીમીટેડ

(ड्यतं३ ग्रुप डंपनी) CIN: L45200GJ1986PLC008717

૨જી. ઓફીસ : એ-૧૦૪, શપથ ૪, કર્ણાવતી કલબની સામે, એસ.જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫. **ફોન :** ૦૭૯ ૬૮૧૬૧૫૦૦ **ફેક્સ :** ૦૭૯ ૬૮૧૬૧૫૬૦ ઈ-મેલ : cs@jmcprojects.com વેબસાઈટ : www.jmcprojects.com

नोटीस

ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ફંડ (આઇઇપીએફ) ઓથોરિટીમાં કંપનીના ઇક્વિટી શેર્સની તબદિલી

કંપની ઘારા, ૨૦૧૩ ની કલમ ૧૨૪(૬) તેમજ ઇન્વેસ્ટર એજચુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રીફંડ) નિયમો, ૨૦૧૬ (નિયમો) કે જેમાં સમચાંતરે કોર્પેરિટ અફેર્સ મંત્રાલય દ્વારા સુધારા જણાવાય છે તેની જોગવાઈઓ અન્વયે અહીં નોટીસ જારી કરવામા આવે છે. કોર્પોરેટ અર્ફેર્સ મંત્રાલય દ્વારા જણાવેલ નિયમો અનુસાર કંપની સતત સાત કે તેથી વધુ વર્ષોથી દાવો કરાચેલ ન હોચ તેવા કિવિકન્ડ સંબંધિત શેરહોલ્કરોના ફિઝીકલ સ્વરૂપમાં કે ડિમટીરીચલાઇઝ્ડ સ્વરૂપે રહેલા શેર્સને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (આઇઇપીએફ ઓથોરિટી) માં તબદિલ કરવા જરૂરી છે.

નિયમો અનુસાર શેરહોલ્ડરોએ નોંધ લેવી કે નાણાંકિય વર્ષ ૨૦૧૪–૧૫ થી બિનચુકવાયેલ/દાવા રહીત અંતિમ ડિવિડન્ડ જે નાણાંકિય વર્ષ ૨૦૧૪–૧૫ થી સતત સાત વર્ષથી દાવો કરાયો નથી તેવા ડિવિડન્ડને સંબંધીત શેર્સ સહીત આઇઇપીએફમાં તબદિલ કરવામાં આવશે. નિયમોમ જણાવાચેલ વિવિદ્ય આવશ્ચકતાઓનું પાલન કરીને કંપનીએ પહેલેથી લાગતા વળગતા શેરહોલ્ડરે જેમના શેર્સ જણાવેલ નિયમો हેઠળ આઇઇપીએફ ઓથોરિટીમાં તબદિલીને પાત્ર છે તેમને વ્યક્તિગત રીતે ચોગ્ય પગલાં લેવા માટે જાણ કરી દીધી છે અને આવા શેરહોલ્ડરોની વિગતો કંપનીની વેબસાઈટ એટલે કે <u>www.jmcprojects.com</u> ઉપર ઇન્વેસ્ટર્સ ટેબ ફેઠળ ઉપલબ્ધ છે. જે સંબંધિત શેરહોલ્ડર્સ ક્રિઝીકલ સ્વરૂપમાં શેર્સ ઘરાવે છે અને જેમના શેર્સ આઇઇપીએકમાં તબદિલીને પાત્ર છે, તેઓ નોંધી શકે છે કે કંપની આઇઇપીએફમાં શેર્સની તબદિલીના હેતુ માટે તેમના દ્વારા ઘરાવવામાં આવતા શેર્સની સામે નવા શેર સર્ટિફિકેટ જારી કરશે અને આવા જારી થચેલ નવા શેર સર્ટિફિકેટને ડિમેટ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે અને આઇઇપીએફની તરફેણમાં તબદિલ કરવા માટે કંપની કોર્પોરેટ પગલાં દ્વારા ડિપોઝીટરીને જાણ કરશે. અસલ શેર સર્ટિફિકેટ કે જે શેરહોલ્ડર્સના નામે રજિસ્ટર્ડ છે તે આપોઆપ જ રદ્ થયેલા ગણાશે અને તેને બિન-વટાવપાત્ર ગણવામાં આવશે. સંબંધિત શેરહોલ્કર્સ જેઓ[ે] કિમટીરીચલાઈઝ્ક સ્વરૂપમાં શેર્સ ઘરાવતા હોચ અને જેમના શેર્સ આઇઇપીએફમાં તબદિલીને પાત્ર છે, તેઓ નોંધ લે કે કંપની આઇઇપીએફના ડીમેટ એકાઉન્ટની તરફેણમાં શેર્સની તબદિલી માટે કોર્પોરેટ પગલાં મારફતે ડિપોઝીટરીને જાણ કરશે. શેરહોલ્ડર્સ વધુમાં એ નોંધી શકે છે કે કંપનીએ તેની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરેલ વિગતો આઇઇપીએફને શેર્સેની તબદિલીના हેતુ માટે કંપની દ્વારા નવા જારી થયેલ શેર સર્ટિફિકેટની બાબતે પુરતી નોટીસ માનવામાં આવશે.

બિનચુકવાચેલ/દાવા રહિત ડિવિડન્ડનો દાવો કરવા માટે લાગતા વળગતા શેરહોલ્ડરો તારીખ 03 નવેમ્બર, ૨૦૨૨ કે તે પહેલા કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ મે. લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા. લી., ૫૦૬ થી ૫૦૮, પાંચમો માળ, અમરનાથ બિઝનેસ સેન્ટર (એબીસી-૧), સેન્ટ ઝેવિર્ચસ કોલેજ કોર્નર, સીજી રોડ પડખે, નવરંગપુરા, અમદાવાદ – 32000લ, ટેલિફોન અને ફેક્સ નંઃ ૦૭૯ ૨૬૪૬૫૧૭૯, ઇમેઇલઃ <u>iepf.shares@linkintime.co.in</u> નો સંપર્ક કરી શકે છે. કંપની નિયમોનું પાલન કરીને નિયત તારીખ સુધીમાં આઇઇપીએફમાં શેર્સ તબદિલ કરશે. તેના પરીણામે કંપની સામે આવા બિન દાવો કરાચેલ ડિવિડન્ડ અને તેને લગતા શેર્સના સંબંધમાં દાવો કરી શકાશે નહી. લાગતા વળગતા શેરહોલ્કરોએ નોંધ લેવી કે ઉપરોક્ત તબદિલીના સંબંધમાં તેઓ જણાવેલ શેર્સ તેમજ ડિવિડન્ડ માટે આઇઇપીએફ ઓથોરીટીમાં દાવો કરી શકે છે જેની વિગતો www.iepf.gov.in ઉપર ઉપલબ્ધ છે. જેએમસી પ્રોજેક્ટ્સ (ઇન્ડિયા) લીમીટેડ વતી

સઠી / સ્થળ : મુંબઈ

તારીખ : જુલાઈ ૨૬, ૨૦૨૨

સમીર રાવલ કંપની સેક્રેટરી (નોકલ અધિકારી)

બેંક ઓક મહારાષ્ટ

ઝોનલ ઓક્સિ અમદાવાદ : બીજો માળ, માવલંકર હવેલી, વસંત ચોક, ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧ TELE- 079-25507901/03 /FAX-079-25509564 e-mail: dzmahmedabad@mahabank.co.in હેડ ઓફિસ : લોકમંગલ, ૧૫૦૧, શિવાજીનગર, પુને-પ

સાંકેતિક કબજા નોટિસ (સ્થાવર મિલકત) નિચમ-૮(૧) Date: 20.07.2022 AX5/Gandhidham/sapna/2022-23

૧(એ) શ્રીમતિ સપના અનુપકુમાર ગુપ્તા, પ્લોટ નં. ૧૧૧/૫, સર્વેનં. ૪૭૪

(ૠણકર્તા) બાગેશ્રી ટાઉનશીપ-૫, ગામ વરામિડી, તાલુકો અંજાર, જિલ્લો કરછ-390૧૧૦

વ(સી) શ્રીમતિ સપના અનુપકુમાર ગુપ્તા, (ઋછકતાં) અનુપકુમાર ગુપ્તાના ઘર્મપત્ની પ્લોટ નં. ૧૧, પહેલો માળ, રૂચિ વિહાર, શુભ મંગલ પેરેડાઇસ, પુષ્પાંજલિ બાગની પાઇળ,

મુંરલીપુરા, મુરલીપુરા જયપુર, રાજસ્થાન-૩૦૨૦૩૯ ર(બી) શ્રી અનુપકુમાર ગુમા, (સહ-ૠણક્તી), લલિતકુમાર નકીપુરીચાના પુત્ર ફલેટ ન એફ-૩, પહેલો માળ, એપેક્સ સોલેસ પ્લોટ નં.દ્ર૧ થી ૬૪, આરએસ નં. ૫૧૪, પૈકી-૧, ગામ વસમિડી, તાલુકો અંજાર,

જિલ્લો કરછ-૩૭૦૧૧૦

ર(સી) શ્રી અનુપકુમાર ગુમા, (સહ-ૠણકર્તા), લલિતકુમાર નકીપુરીયાના પુત્ર પ્લોટ નં. ૧૧, પહેલો માળ, રૂચિ વિહાર, શુભ મંગલ પેરેડાઇસ, પુષ્પાંજલિ બાગની પાછળ, મુરલીપુરા, मुरेवीपुरा क्यपुर, राकस्थान-

૧(બી) શ્રીમતિ સપના અનુપકુમાર ગુપા, (ૠણકતા) ફ્લેટ નં. એફ-૩, પહેલો માળ, એપેક્સ સોલેસ પ્લોટ નં.૬૧ થી

ગામ વસમિડી, તાલુકો અંજાર, જિલ્લો

ર(એ) શ્રી અનુપકુમાર ગુમા, (સહ-ૠણકતી), લિતતુમાર નકીપુરીયાના પુત્ર પ્લોટ નં. ૧૧૧/૫, રાવેં નં. ૪૭૪ બાગેશ્રી ટાઉનશીપ-૫,

ગામ વર્સામેડી, તાલુકો અંજાર, જિલ્લો

દ્ઠ, આરએસ નં. ૫૧૪, પૈકી-૧,

આથી, નીચે સહી કરનાર બેંક ઓફ મહારાષ્ટ્રના અધિકૃત અધિકારીએ शिक्योरीटाएप्रेशन अन्ड रिकन्स्ट्रक्शन ओक् क्षणनान्सियल असेट्स अन्ड એन्ફોર्સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ તથા સિક્યોરીટી ઇન્ટરેસ્ટ અન્ફાસમન્ટ ઓફ સિક્યારટા ઇન્ટરસ્ટ એક્ટ ૨૦૦૨ તથા સિક્યારાટા ઇન્ટરસ્ટ (એન્ફ્રાસમિન્ટ)૨૦૦૨ના નિયમ ૮ સહિત વેચાણે લેતા કલમ ૧૩ની પેટા કલમ (૧૨) હેઠળ મળેલ રાત્તાની રૂએ તારીખ ૨૨-૦૨-૨૦૨૨ ના રોજ ડીમાંગડ નોટિસ પાઠવી હતી, જે અનુસાર બેંકના બ્રહ્મકર્તા શ્રીમિત સપના અનુપકુમાર ગુમા, (ઋલક્તા) અને શ્રી અનુપ કુમાર ગુમા, (ઋલક્તા) ને બેંકની કુલ લેશી ૨૬મ ગુમા, (ઋલક્તા) ને બેંકની કુલ લેશી ૨૬મ ગુમા, (૨૧ + નારીખ ૧૩-૦૨-૨૦૨૨) ટર્મ લોન પર ૭.૧૫% ના દરે તેની ઉપર ચડતું ત્યાજ વગેરે, આ નોટિસ મળ્યેથી દૃ૦ દિવસની અંદર પરત ચૂક્તવા માટે નોટિસ આપેલ હતી.

આ નોટિસ બેંકના બાકી લેણાની ચૂકવણી માટે ૠણકર્તા તથા જામીનકર્તાઓને રજુસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી. આ રકમ ચૂકવવામાં ૠણકતા નિષ્ફળ જવાથી ખાસ ૠણકર્તા અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે નીચે सही हरनारे ઉपरोहत नियमोना नियम ८ साथे वंचाछे वेतां ઉपरोहत એहटर्न કલમ ૧૩(૪) હેઠળ દોમને મળેલી રાત્તાની ઋરએ નીચે જણાવેલ મિલકતન કબજો તા.૨૦-૦૯-૨૦૨૨ ના રોજ મેળવી લીધેલ છે.

ખાસ કરીને ૠણકર્તા તથા જાહેર જનતાને આ મિલકત અંગે કોઇપણ વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે તથા આ મિલકત અંગે કરેલ કોઇપણ વ્યવહાર ઉપર જણાવેલ રકમ માટે બેંક ઓફ મહારાષ્ટ્રના ઉપર જણાવ્યા મુજબન ચાર્જને આધીન રહેશે.

બેંકની ગીરો મુકેલ મિલકત તથા બેંક દ્વારા લેવાયેલ કબજાની વિગતો નીચે મુજબ છે.

१) स्थावर मिलङतनो तुमाम ભाગ અने हिस्सो,ः ય) રવાવર મહિકતના તમામ ભાગ અના હ્રિસા. પહેલા માળ પ્યર ક્લેટ નં. ૦૩, પ્લોટ નં.દ્૧ થી દૃ૪, એપેક્સ સોલેસ, આરએસ નં. ૫૧૪/પૈકી-૧, કંડલા એરપોર્ટ પાસે, ગામ વસમિંડી, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ-૩૭૦૧૧૦ ક્ષેત્રફળ આશરે દૃ૮.૦૬ ચો.મી. એપેક્સ સોલેસ, શ્રી વિશાલસિંગ દિલીપસિંગ જાડેજા દ્વારા બંધાચેલ અને વિકસિત. तेनी ઉपरना ड़िक्स्स अने इनियर्स साथे.

વિતુ: કલેટ નં. એફ-૨, દક્ષિણે : ખુલ્લી જગ્યા અને ફલેટ નં. એફ-૬, પૂર્વે : ખુલ્લી જગ્યા અને ગાર્ડનનો ત્યું, પશ્ચિમે : ફ્લેટ નં. એફ-૪. તેની ઉપરના ફિક્ચર્સ અને ફનિચર્સ સાથે.

વતી/- બેંક ઓફ મહારાષ્ટ્ર

(સુબોદ્ય એકનાથ શેલાર) ચીક મેનેજર / સરફેસી એક્ટ, ૨૦૦૨ હેઠળ અધિકૃત અધિકારી અમેદાવાદ ઝો

Place: Noida (U.P.)

Date: July 26, 2022

THE YAMUNA SYNDICATE LIMITED

Registered Office: Radaur Road, Yamunanagar – 135001, Haryana CIN: L24101HR1954PLC001837, Ph.: +91-1732-255479

mail:companysecretary@yamunasyndicate.com, Website:www.yamunasy NOTICE OF THE 68TH ANNUAL GENERAL MEETING AND E-VOTING

 NOTICE is hereby given that pursuant to Section 108 of Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (LODR), as amended, Secretarial Standards on General Meetings (SS- and all the applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and Securities Exchange Board of India (SEBI), the Company is providing to its Members facility to exercise their right to vote by electronic means on all the resolutions proposed to be considered in the Annual General Meeting (AGM) of the members of the Company scheduled to be held on Thursday, August 25, 2022 at 11:00 a.m. (IST) through Video Conferencing ('VC') or Other Audio Visual Means ('OAVM') for which purpose the Registered Office of the Company situated at Radaur Road, Yamunanagar-135001, shall be deemed as the venue for the meeting. The Company has engaged the services of National Securities Depository (NSDL) as the Agency to provide remote e-voting facility as well as e-voting during the AGM.

for Financial Year 2021-22 have also been sent through electronic mode to all the members whose email IDs are registered with the Company/Depository participant(s) on Monday, July 25, 2022. The same is also available on the Company's website i.e. www.yamunasyndicate.com and on the BSE website www.bseindia.com and on the NSDL website www.evoting.nsdl.com iii) The remote e-voting facility will commence on Monday, August 22, 2022 from 9:00 A.M. and will end on Wednesday, August 24,

ii) In compliance with aforesaid MCA and SEBI circulars, the Notice of

AGM along with instructions for e-voting and Annual Report of Company

2022 at 5:00 P.M. The remote e-voting shall not be allowed beyond the said date and time. Only those persons, whose name appears in the register of Members/Beneficial owners as on the Cut-off date i.e. Thursday, August 18, 2022 shall be entitled to avail the facility of emote e-voting as well as e-voting during the meeting.

iv) Any person who becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on Cut-off date i.e. August 18, 2022 can obtain User ID and password as per the instructions provided in the Notice of AGM for e-voting. A person already register with NSDL/CDSL for e-voting can use his/her existing User ID and Password for casting vote.

 v) The members are being provided with a facility to attend the AGM through VC/OAVM through NSDL platform. The instructions for attending the AGM through VC/OAVM are provided in Notice of AGM. The Members, who shall have already cast their vote by remote e-voting may attend the meeting, but shall not be entitled to cast their e-vote again during the meeting.

vi) Mr. Pramod Kothari, practicing company secretary (Membership no. F7091) (E-mail: ppdkothari71@gmail.com) has been appointed as the Scrutinizer to scrutinize the electronic voting process, in a fair and transparent manner.

vii) The procedure for electronic voting is available in the Notice of AGM. In case of any query relating to voting by electronic means, the Members can call on toll free no.: 1800-1020-990 and 1800-22-44-30 or send a request to NSDL at evoting@nsdl.co.in. who will address the query/grievances connected with the voting by electronic means. The Members may also contact to the Company Secretary at companysecretary@yamunasyndicate.com Notice of Book Closure

NOTICE is also given that pursuant to provisions of Section 91 of Companies Act 2013 and Rules made there-under and as per Regulation 42 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, August 19, 2022 to Thursday, August 25, 2022 (both days inclusive) for the purpose of AGM and for the purpose of payment of Final Dividend.

For The Yamuna Syndicate Ltd. Sd/- (Ashish Kumar) Company Secretary Dated : July 26, 2022 Place: Yamuna Nagar - 135001

Triveni Turbine Limited CIN: L29110UP1995PLC041834

Regd. office: A-44, Hosiery Complex, Phase-II Extn., Noida, Uttar Pradesh - 201 305 Corporate office: 8th Floor, Express Trade Towers, 15-16, Sector - 16A, Noida,

Uttar Pradesh - 201301 $\textbf{E-mail:} \ \underline{shares.ttl@trivenigroup.com}, \ \textbf{Website:} \ \underline{www.triveniturbines.com},$ Phone: 91 120 4308000 / Fax: 91 120 4311010-11

27th Annual General Meeting to be held through Video Conference ("VC")/other Audio Visual Means("OAVM")

Notice is hereby given that the 27th Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, August 23, 2022 at 11.30 A.M. IST through Video Conferencing ("VC")/other Audio Visual Means ("OVAM"), to transact the businesses as set forth in the Notice of the AGM, which will be circulated

for convening the AGM. The MCA Circulars read with the Securities and Exchange Board of India ("SEBI") Circular no. SEBI/HO/CFD/CMD2/ CIR/P/2022/62 dated May 13, 2022 ("SEBI Circular"), has dispensed with the requirement of sending the physical copies of the AGM Notice and Annual Report to the members. Accordingly, the Notice of the AGM and the Annual Report (2021-22) of the Company

are being sent only through electronic mode to those members whose e-

mail addresses are registered with the Company / Depositories. Members may note that the copies of the Notice of the AGM and the Annual Report (2021-22) will also be made available on the website of the Company at www.triveniturbines.com, websites of the Stock Exchanges, BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com, respectively, and website of KFintech at https://evoting.kfintech.com ("Kfintech"), the agency appointed for

facilitating e-voting (including remote e-voting) for the AGM. Members who have not registered their e-mail address will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through remote e-voting or through e-voting system ("Insta Poll") during the AGM. The manner of voting remotely for this purpose will be provided in the Notice to the members. The details will also be available on the website of the Company at www.triveniturbines.com and on

the website of KFintech at $\underline{\text{https://evoting.kfintech.com}}.$ Members who have not registered their e-mail address and in consequence the Annual Report. Notice of AGM and e-voting notice could not be serviced may get their e-mail address and mobile number temporarily registered with KFintech, by clicking the link: https://ris.kfintech.com/clientservices/mobilereg/

mobileemailreg.aspx for sending the same. For Permanent registration of e-mail address and bank mandate members Holding shares in Demat mode are requested to complete and/or update their residential status, PAN, Category with their DPs.

Holding shares in physical form duly filed and signed form ISR-1 along with a self-attested copy of the PAN card, Aadhar Card and cancelled cheque leaf to the Company's RTA M/s Alankit Assignments Limited - Unit Triveni Turbine Ltd, 4E/2, Jhandewalan Extension, New Delhi 110055.

Members may note that the Board of Directors recommended a final dividend of Rs 0.85 and a special dividend of Rs 0.70 per share of face value of Re 1/- each at its meeting on May 13th, 2022. The record date for determining eligibility for final and special dividend payments is August 16. 2022. If approved by members at the AGM, the dividend will be paid electronically to members who have updated their bank account information to receive dividends electronically. Dividend warrants/demand draft will be mailed to members who have not updated their bank account information, subject to postal service availability. To avoid delay in receiving dividend,

Members are requested to follow the process as guided to capture their email address and mobile number for sending the soft copy of the notice and e-voting instructions along with their user ID and password. In case of any queries, members may write to einward.ris@kfintech.com. Members may also send an email request to einward.ris@kfintech.com, along with a scanned copy of the signed request letter, email address, mobile number, self-attested PAN copy and Client Master copy in case of electronic folio, and a copy of the share certificate in case of physical shareholding.

members are requested to update their bank account details.

Pursuant to the Income Tax Act, 1961 as amended by the Finance Act, 2020, dividend income is taxable in the hands of members and the company is required to deduct tax at source from dividends paid to members at the prescribed rates. Members are requested to refer to the TDS instructions on Dividend Distribution available on the website of the Company www.triveniturbines.com, and submit all requisite documents on or before 9th August 2022 to Kfintech to determine the appropriate TDS rates, as

The 27th AGM Notice will be issued to members in compliance with the applicable laws on their registered email id in due course.

For Triveni Turbine Limited Sd/-

Rajiv Sawhney

Company Secretary